

ત્વરિત જાહેરાત માટે

સીટી એનાઉન્સીસ ન્યુ ઝુમ ટ્રાન્ઝિટ કનેક્શન બિટ્વીન બ્રેમ્પટન એન્ડ ટોરોન્ટો પિયરસન ઈન્ટરનેશનલ એરપોર્ટ (સીટીએ બ્રેમ્પટન અને ટોરોન્ટો પિયરસન ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે નવી ઝુમ ટ્રાન્ઝિટની ઘોષણા કરી)

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (માર્ચ 3, 2020) – સીટી ઓફ બ્રેમ્પટનને બ્રેમ્પટનથી ટોરોન્ટો પિયરસન ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી નવી સીધી બસ રેપિડ ટ્રાન્ઝિટ જોડાણની ઘોષણા કરતા ખુશી થાય છે. 505 ઝુમ બોવર્ડ રૂટને એરપોર્ટ સુધી લંબાવવામાં આવશે અને તે આ વર્ષ 2020 ની પાનખર ઋતુમાં શરૂ થાય તેવી અપેક્ષા છે.

બ્રેમ્પટન સીટી કાઉન્સિલે શહેરના 2020 બજેટના ભાગરૂપે આને સર્વાનુમતે મંજૂરી આપી. આ વિસ્તરણથી પ્રાદેશિક જોડાણ સુધરશે, ટોરોન્ટો પિયરસન પર કામ કરતા અથવા ત્યાંથી પ્રવાસ કરતા રહેવાસીઓ માટે વધારે અનુકૂળતા આપશે, અને ઈનોવેશન કોરિડોર સુધી બ્રેમ્પટનના જોડાણોને વધારે મજબૂત કરશે.

પિયરસન એરપોર્ટ વિશાળ અને કામ કરવા એક જટિલ સ્થળ છે, જ્યાં 400 ઉપરાંત કંપનીઓમાં લગભગ 50,000 લોકો નોકરી કરે છે; જેમાંના 10,000 લોકો બ્રેમ્પટનમાં રહે છે. પિયરસન બ્રેમ્પટન, મિસિસાગા અને એટોબિકોના વિસ્તારો સહિતના, એરપોર્ટ એમ્પ્લોયમેન્ટ ઝોન માટે એક લંગર (કેન્દ્રીય સ્નેહાકર્ષિત સ્ત્રોત) છે, અને કેનેડામાં 300,000 થી વધારે નોકરીઓ આપતો બીજા નંબરે સૌથી વિશાળ રોજગાર વિસ્તાર છે.

ગ્રેટર ટોરોન્ટો એરપોર્ટ્સ ઓથોરિટી (GTAA) નવા રૂટને આવકારે છે, કારણ કે સંશોધને દર્શાવ્યું છે કે બ્રેમ્પટન અને એરપોર્ટ વચ્ચે સીધા બસ જોડાણો સુધારવાના નોંધપાત્ર લાભો રહેલા છે. 505 ઝુમ બોવર્ડ એક્સટેન્શનથી પબ્લિક ટ્રાન્ઝિટ લેતા બ્રેમ્પટન-સ્થિત એરપોર્ટ કર્મચારીઓની હાલની સંખ્યા અમણી થઈ શકે છે.

ટોરોન્ટો પિયરસનમાં, બ્રેમ્પટન ટ્રાન્ઝિટ વપરાશકારો અપ એક્સપ્રેસ, છ ટીટીસી રૂટ્સ, ચાર માયવે રૂટ્સ, બે ગો ટ્રાન્ઝિટ રૂટ્સ અને ગ્રેહાઉન્ડ જેવી અન્ય પ્રાદેશિક સેવાઓ સહિતના અન્ય પ્રાદેશિક પરિવહન નેટવર્ક્સ સાથે જોડાઈ શકે છે.

ઝડપી હકીકતો

- 2020 નાં બજેટમાં શહેરની ટ્રાન્ઝિટ માળખાગત સગવડ સુધારવા 1 ટકા દર (લેવી) સમાવવામાં આવ્યો હતો.
- રૂટ 505 ઝુમ બોવર્ડ વિસ્તરણમાં \$1.75 મિલિયનનો ખર્ચ થશે - \$900,000 ભંડોળ સીટી પૂરું પાડશે, જ્યારે બાકીનો ખર્ચ આવકમાંથી પહોંચી વળવામાં આવશે.
- હાલમાં, ટોરોન્ટો પિયરસન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્યરત 10,000 બ્રેમ્પટન રહેવાસીઓમાંથી 13 ટકા લોકો કામ પર અવરજવર કરવા પબ્લિક ટ્રાન્ઝિટનો ઉપયોગ કરે છે.

અવતરણો (ક્વોટ્સ):

“ઈનોવેશન કોરિડોરના અને એરપોર્ટના કાર્યબળને ટોચનો ક્ષણો આપનારના ભાગ તરીકે, અમને અમારા પ્રદેશના આર્થિક વિકાસને સહાયતા કરવા અને નોકરીની તકો સુધી બ્રેમ્પટન રહેવાસીઓની પહોંચ સરળ બનાવવામાં ખુશી થાય છે. વર્ષ 2020 નું બજેટ મહત્વના રોકાણો કરવામાં આવનાર છે જે સમુદાયને પહેલા ધ્યાનમાં રાખે છે.”

- **પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન**

“આજની ધોષણથી ઉતારુઓ અને કર્મચારીઓ બંનેને બ્રેમ્પટનથી ટોરોન્ટો પિયરસન સુધીની પહોંચ વધારે સહેલાઈથી પૂરી પાડી શકાશે. લોકો અને ધંધાઓને દુનિયાના ત્રણ-ત્રત્યાંશ (થ્રી-ક્વાર્ટર્સ) સાથે કાર્યક્ષમ રીતે જોડવા, અમને મજબૂત સ્થાનિક ગ્રાઉન્ડ કનેક્શનસની જરૂર છે. આ સેવા બ્રેમ્પટનની એરપોર્ટ અને દુનિયા સુધીની પહોંચ વધારે સુદૃઢ બનાવે છે.”

- **સ્કોટ કોલિયર (Scott Collier), ઉપ પ્રમુખ, કસ્ટમર અને ટર્મિનલ સેવાઓ, GTAA**

“વર્ષ 2020 નાં મંજૂર થયેલા બજેટમાં આ ટ્રાન્ઝિટ વિસ્તરણ જેવા વ્યૂહાત્મક રોકાણોનો સમાવેશ થયો જે કાઉન્સિલની અગ્રતાઓને સાથે રાખીને બ્રેમ્પટન તકો આપતું શહેર હોવાની ખાતરી કરાવે છે. આ બજેટથી આપણાં રહેવાસીઓ માટે ઉચ્ચ-ગુણવત્તાની ટ્રાન્ઝિટ સેવાઓનું વિતરણ વધે છે જેથી ખાતરી કરી શકાય કે રહેવાસીઓ રોજગાર તકોની પહોંચ ધરાવી શકે છે અને એમ્પ્લોયર્સ બ્રેમ્પટનની પ્રતિભાઓ સુધી પહોંચ મેળવી શકે છે.”

- **ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન**

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca